

સિંગ્રંગડેલ બ્રેમ્પટન લાઈબ્રેરી ખાતે માય બ્રેમ્પટન ડે ની ઉજવણી

સીટી ઓફ બ્રેમ્પટન અને CBC સહ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (14 માર્ચ 2022) – CBC શહેરને વધાવી રહ્યા છે અને લાવી રહ્યા છે માય બ્રેમ્પટન ડે જે સિંગ્રંગડેલ બ્રેમ્પટન લાઈબ્રેરીમાં માર્ચ 30ના રોજ હાથ ધરાશે. આમાં સીટી ઓફ બ્રેમ્પટન, બ્રેમ્પટન લાઈબ્રેરી અને આર્ટસ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી (ACCIDA)નો સહયોગ સાંપડ્યો છે.

માય બ્રેમ્પટન ડે

સિંગ્રંગડેલ બ્રેમ્પટન લાઈબ્રેરી

10705 બ્રેમલી રોડ (Bramalea Road)

બુધવાર, માર્ચ 30

ઈવેન્ટ્સનું સમયપત્રક

- સવારે 11 વાગ્યે બ્રેમ્પટનના શિલ્પકાર અભિઓલા ઈડોવુ દ્વારા સર્જાયેલ શિલ્પનું અનાવરણ થશે જેને CBC ટોરોન્ટો દ્વારા કમિશન કરવામાં આવ્યું છે
- બપોરે 12 વાગ્યે - અભિઓલા ઈડોવુ સાથે કલા અંગેની ગોષ્ઠી જેની સહરજૂઆત ACCIDA સાથે થશે
- સાંજે 5:30 વાગ્યે - CBC ટોરોન્ટોનું ઈન્ટરએક્ટિવ શ્રવણ સત્ર
- સાંજે 7:30 વાગ્યે - ઓલ રોડ્સ લિડ ટૂ બ્રેમ્પટન, CBC ટોરોન્ટોના બ્રેમ્પટન બ્યુરોના નવ નાનવા દ્વારા રજૂ થનાર એક પેનલ ચર્ચા

અભિઓલા ઈડોવુ સાથે નિઃશુલ્ક લાઈવ વિન્ડો મ્યુરલ આર્ટિસ્ટ એક્ટિવેશન

આના સહયોગીઓ છે સીટી ઓફ બ્રેમ્પટનની આર્ટસ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી (ACCIDA), જેમાં સ્થાનિક કલાકાર અભિઓલા ઈડોવુ સાથે લાઈબ્રેરીને તમારું કેનવાસ બનાવવાની તક સાંપડશે. સહભાગીઓને લાઈબ્રેરીની મોટી

કાયની બારીઓ પર સ્કેચ બનાવવા અને દોરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તમામ વયના લોકો આવકાર્ય છે અને કોઈ અનુભવની આવશ્યકતા નથી.

ટિકિટો નિ:શુલ્ક છે અને પુષ્ટિ થયેલ હોય એવા અતિથીઓ મેળવશે એક મર્યાદિત-સંસ્કરણ CBC ટોરોન્ટો બ્રેમ્પટન પ્રેરિત સ્વેગ પેક. વિગતો માટે અને રજીસ્ટર થવા અહીં મુલાકાત લો cbc.ca

CBC ટોરોન્ટોએ 2021ની પાનખરમાં એક વિશેષ બ્રેમ્પટન બ્યુરોનું નિર્માણ કર્યું હતું. પત્રકારો અને નિર્માતાઓની એક સમર્પિત ટીમ બ્રેમ્પટન ખાતે મેદાને પડી છે જેઓ એવા અહેવાલો આપી રહ્યા છે જે સ્થાનિક સમુદાય માટે અગત્યના હોય.

સુવાક્યો

"સિંગ્રેડેલ બ્રેમ્પટન લાઈબ્રેરીની શાખા ખાતે CBC તેમના માય બ્રેમ્પટન ડેના ઈવેન્ટના ભાગરૂપે આપણા શહેરને વધાવીને શહેરની વાતો જણાવી રહ્યા છે તે હકીકતથી અમે રોમાંચિત છીએ. બ્રેમ્પટનની સાંસ્કૃતિક વિવિધતા એ છે જે આ શહેરને ખૂબ જ ખાસ બનાવે છે અને તેને સમુદાયની સાથે ઉજવવી તે આનંદની વાત છે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન ખાસ છે તેની કદર કરવા માટે CBCને ધન્યવાદ. ACCIDA અને સ્થાનિક કલાકાર અભિઓલા ઈડોવુ તેમની સર્જનાત્મકતા આ ઈવેન્ટમાં લાવીને આપણા વૈવિધ્ય અને પચરંગીપણાને વધાવી લે છે તે જોઈને તેમજ જાહેર કલાના માધ્યમથી સમાજ સાથે જોડાઈ રહ્યા છે તે જોઈને ખરેખર આનંદ થાય છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન; કાઉન્સિલ પેનલ સભ્ય, આર્ટ્સ કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવેલપમેન્ટ એજન્સી

"સમુદાયને ચમકાવીને અને કેટલીક જોરદાર બાબતો જે આ શહેરમાં થઈ રહી છે તેને માટે CBC ટોરોન્ટોને બ્રેમ્પટન લાઈબ્રેરી સાથે સહયોગ કરતા રોમાંચની લાગણી થાય છે. રૂબરૂમાં બ્રેમ્પટનવાસીઓ સાથે જોડાવાની તક મેળવવા માટે અમે ઉત્સુક છીએ."

- પ્રસન્ના રાજગોપાલન, ડિરેક્ટર, પત્રકારિત્વ + પ્રોગ્રામિંગ CBC ટોરોન્ટો

"આ રોમાંચક ઈવેન્ટ માટે બ્રેમ્પટન લાઈબ્રેરી CBC સાથે સહયોગ કરી રહ્યા છે તેનો અત્યંત આનંદ છે. લોકોને ફરીથી રૂબરૂ ઈવેન્ટમાં આવકારવા માટે અમે ખૂબ જ રોમાંચિત છીએ અને તે તક માટે ઉત્સુક છીએ જ્યારે બ્રેમ્પટનના રહેવાસીઓ પોતાના સમાજને નવેસરથી ઓળખશે અને નવા જોડાણો કરવા પ્રેરિત થશે!"

- ટોડ કાર્લ, ચીફ એગ્ઝિક્યુટિવ ઓફિસર, બ્રેમ્પટન લાઈબ્રેરી

આ વિશેષ દિને બ્રેમ્પટન લાઈબ્રેરી અને CBC ખાતેના મિત્રો સાથે સહયોગ સ્થાપના ACCIDA રોમાંચિત છે - જેમાં સામેલ છે અભિઓલાના નવા શિલ્પનું અનાવરણ અને અમારું ઈન્ટરએક્ટિવ વિન્ડો ઈન્સ્ટોલેશન. બ્રેમ્પટન પરચરંગી છે અને કલા તથા સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર છે. આવી અનોખી રીતે અમારી સંસ્થા કલાના સમુદાયને સ્થાનિક પ્રતિભા અને સંસાધનો દાખવી શકશે તેનાથી અમે રોમાંચિત છીએ."

- નુવી સિધુ, પ્રમુખ, કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક ઉદ્યોગ વિકાસ એજન્સી (ACCIDA)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca